

તાત્કાલિક પ્રકાશન માટે

બ્રામ્પટને આર્ટ્સ વૉક ઓફ ફ્રેમ (એડબલ્યુઓએફ) ઇન્ડક્ટીસની જાહેરાત કરી

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ડિરેક્ટર X, ન્યુયોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલિંગ ઓથર રૂપી કૌર, CBC ની મોર્નિંગ એડિશનની હોસ્ટ ઝાકરા નવાઝ, અને ઇતિહાસકાર અને રાજવી વંશજ વિલિયમ પર્કિન્સ બુલ, આ તમામ પ્રખ્યાત બ્રામ્પટન રહેવાસીઓ અને રસેલ પીટર્સ અને માઈકલ સેરા સહિતના ભૂતપૂર્વ ઇન્ડક્ટીસની યાદીમાં જોડાશે

બ્રામ્પટન, ઓન્ટેરિયો, એપ્રિલ 10, 2018: સીટી ઓફ બ્રામ્પટને આજે તદ્દન નવા આર્ટ્સ વૉક ઓફ ફ્રેમ ઇન્ડક્ટીસના નામોની ઘોષણા કરી. બ્રામ્પટનથી અભિવાદન મેળવતા અથવા ત્યાં ઘડતરના વર્ષો વિતાવ્યા હોવાને લીધે, કળા અને મનોરંજન ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા, બ્રામ્પટન સમુદાયમાં ગૌરવ ઊભું કરવા માટે, અને ઉભરતા કળાકારો અને રચનાકારોના પ્રેરણાસ્ત્રોત બનવા બદલ દરેકની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષના ઇન્ડક્ટીસમાં છે:

- **ડિરેક્ટર X** – જુલિયન ક્રિસ્ટિયન લુટ્ઝ નામ લઈને જન્મેલા, ડિરેક્ટર X ઊંચા-બજેટના, પ્રખ્યાત કળાકારો જેમ કે રૂક, કેનિફ લમાર, રિહાના, જય-એડ, જસ્ટીન બીબર, કેન્યે વેસ્ટ અને ઘણાં બધાં માટે જોવામાં વિશિષ્ટ વીડિયોનું દિગ્દર્શન કરવા બદલ જાણીતા થયા છે. તેમની કામગીરી MTV મ્યુઝિક વીડિયો એવોર્ડ્સ અને ઘણાં સંગીત વીડિયો એવોર્ડ્સ માટે નામાંકિત અને એવોર્ડ અપાવનાર થઈ છે. વર્ષ 2015 માં, X ને તેમની દિગ્દર્શનની શરૂઆત, 'ACROSS THE LINE' (એકોસ ધી લાઈન) માટે એટલાન્ટિક ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફીચરનો, અને તાજેતરમાં દિગ્દર્શિત બહુ પ્રતીક્ષિત ફિલ્મ "Superfly" (સુપરફ્લાય) માટે સોની, કોલંબિયા પિક્ચર્સ તરફથી એવોર્ડ મળ્યો જે જૂન 2018 માં થિયેટરોમાં જોવા મળશે. (www.directorXfilms.com)
- **રૂપી કૌર** – રૂપી કૌર એક કવિ, કળાકાર અને નાટકકાર છે. તેણીનો કળાત્મક પ્રવાસ 5 વર્ષની ઉંમરે શરૂ થયો જ્યારે તેણીની માતાએ તેણીને પેઈન્ટબ્રશ આપીને કહ્યું, "તારા દિલની વાત દોરીને બતાવ." યુનિવર્સિટી ઓફ વોટરલૂમાં અભ્યાસ કરતી વખતે, રૂપીએ તેણીનું પ્રથમ કલેક્શન, *Milk and Honey* (મિલ્ક એન્ડ હની)નું લેખન, ચિત્રણ અને જાતે પ્રકાશન કર્યું જેની ત્યારથી 3 મિલિયન ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે, 35 થી વધારે ભાષાઓમાં ભાષાંતર થયું છે, અને સતત 100 અઠવાડિયાઓ માટે #1 ન્યુયોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર રહી છે. રૂપીનું લાંબા-સમયથી રાહ જોવાતું સેકન્ડ કલેક્શન *The Sun and Her Flowers* (ધી સન એન્ડ હર ફ્લાવર્સ) 2017 માં પ્રકાશિત થયું અને વૈશ્વિક સ્તરે #1 તરીકે ધમાકેદાર પ્રવેશ મેળવ્યો. તેણીએ ફોર્બ્સની 30 વર્ષ નીચેની ખ્યાતિમાન 30 વ્યક્તિઓમાં સ્થાન મેળવ્યું અને તેણી 2017 ની BBC ની 100 મહિલાઓમાં નામાંકિત થઈ. (www.rupikaur.com)
- **ઝાકરા નવાઝ** – ઝાકરા નવાઝ 2005 નું ક્રાંતિકારી દસ્તાવેજી *Me and the Mosque* (મી એન્ડ મોસ્ક) ની રચયિતા રહી છે, અને કોમેડી શ્રેણી *Little Mosque on the Prairie* (લીટલ મોસ્ક ઓન ધી પ્રેઈરી) હિટ રહી છે જે વર્ષ 2007 અને 2012 વચ્ચે CBC ટેલીવીઝન પર ચાલી હતી. સૌથી તાજેતરમાં તેણીએ બેસ્ટ સેલિંગ વિનોટી સ્મરણકથા, *Laughing All the Way to the Mosque* (લાઈંગ ઓલ ધી વે ટૂ ધી મોસ્ક) લખી છે જેમાં તેણી મુસ્લિમ ધર્મની કેનેડિયન નાગરિક તરીકે ઉછરના અનુભવની ઝાંખી કરાવે છે. નવાઝ હાલમાં CBC ની *ધી મોર્નિંગ એડિશન* ની હોસ્ટ છે. (www.zarqanawaz.com)
- **વિલિયમ પર્કિન્સ બુલ, સાહિત્ય (મરણોત્તર)** – વિલિયમ પર્કિન્સ બુલ એક સફળ વકીલ, નાણાં ધીરનાર, ફિલેન્થ્રોપિસ્ટ (પરોપકારી) અને ઇતિહાસકાર હતા. 1930 નાં દસકાની શરૂઆતમાં તેમણે પીલ કાઉન્ટીના ઇતિહાસનો વ્યાપક અભ્યાસ શરૂ કર્યો જે છેવટે પીલના સાંસ્કૃતિક અને કુદરતી ઇતિહાસ પર તેર પ્રકાશિત વોલ્યુમ્સમાં વિકસ્યું. બુલના ઇતિહાસ પ્રોજેક્ટનું પરિણામ છેવટે આર્ટિકલ્સ, આર્કાઇવલ રેકોર્ડ્સ અને આર્ટવર્ક્સના બહુ વિશાળ સંગ્રહનું પણ આવ્યું. 2006 માં, પીલ હેરિટેજ ફોર્મલેક્સ (હવે પીલ આર્ટ ગેલેરી, મ્યુઝિયમ અને આર્કાઇવ્સ) આર્કાઇવ્સ રીડિંગ રૂમનું નામ ઔપચારિક રીતે બદલીને વિલિયમ પર્કિન્સ બુલ રીડિંગ રૂમ કર્યું, અને 2007 માં ઓન્ટેરિયો હેરિટેજ ટ્રસ્ટે પ્રાંતીય ઐતિહાસિક નોંધપાત્રતા સ્થાપિત કરવા માટે શ્રી બુલનું સન્માન કર્યું.

ઇન્ડક્ટીસની કળાત્મક કામગીરી વ્યક્તિગત પ્રેઝન્ટેશન પ્રસંગોમાં દર્શાવવામાં આવશે અને યશસ્વી થશે, ત્યાર પછી તેઓને આર્ટ્સ વૉક ઓફ ફ્રેમના ભાગ તરીકે ઓળખ મળશે. આમાંનો પહેલો પ્રેઝન્ટેશન પ્રસંગ *An Evening with Rupī Kaur* (એન ઇવનિંગ વીથ રૂપી કૌર) રહેશે, જેનું આયોજન ગુરુવાર એપ્રિલ 26, 2018 નાં રોજ ધી રોઝ થિયેટરમાં કરવામાં આવશે. વિગતો અને ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ છે, www.rosetheatre.ca.

આટર્સ વોક ઓફ ફ્રેમ 2014 માં શરૂ થયું ત્યારથી નવા ઈન્ડક્ટીસ કુલ સ્ટાર્સની સંખ્યાને 21 પર પહોંચાડશે. ભૂતપૂર્વ ઈન્ડક્ટીસમાં રસેલ પીટર્સ, માર્કલ સેરા, ઓથાલી ગ્રેહામ, કેશિયા શેન્ટે, એક્સકો લેવી, રોહિન્ટન મિસ્ત્રી, અને ઘણાંનો સમાવેશ થશે. ધી આટર્સ વોક ઓફ ધી ફ્રેમ ડાઉનટાઉન બ્રામ્પટનમાં ગાર્ડન સ્ક્વેરમાં સ્થિત છે. આ વિસ્તારમાં બાંધકામ થઈ રહ્યું હોવાને લીધે, 2017 ઈન્ડક્ટીસ માટે માર્કસેનું ઈન્સ્ટોલેશન ભવિષ્યની તારીખ સુધી લંબાશે. ઈન્ડક્ટીસની સંપૂર્ણ યાદી અને આ વર્ષના પ્રેઝન્ટેશન પ્રસંગો પર વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/artswalkoffame.

આટર્સ વોક ઓફ ફ્રેમ, સીટી ઓફ બ્રામ્પટનના મહત્વના ઓળખ કાર્યક્રમો પૈકી એક છે, જે બ્રામ્પટનમાં કળાકારો અને રચનાકારોની આગામી પેઢીને તેઓના પગલાઓ અનુસરવા પ્રેરણામય બનીને, બ્રામ્પટનમાંથી ઉભરતી અદ્ભુત કળાત્મક અને રચનાત્મક પ્રતિભા સાથે જોડાણો બનાવે છે અને વખાણે છે.

અવતરણ (ક્વોટ):

“ગુંજ ઉઠતી કળા અને સંસ્કૃતિ શહેરને સજ્જડ બનાવે છે. બ્રામ્પટનમાં મૂળ ધરાવતા આશ્ચર્યજનક પ્રતિભાશાળી લોકો અહીં અને દેશભરમાં આપણાં માટે ચોડયાતા ગૌરવનો સ્ત્રોત છે. આટર્સ વોક ઓફ ફ્રેમ આપણાં માટે કળાકારોને વખાણવાની રીત છે જેઓ ન કેવળ પોતાના ક્ષેત્રમાં પાવરધા હોય છે, પરંતુ તેઓ આપણાં શહેર સાથે જોડાયેલા પણ છે. કાઉન્સિલર્સ અને રહેવાસીઓ વતી, અમને તેઓની ઉપલબ્ધિઓને ઓળખ અપાવવામાં ખુશી થાય છે.”

-- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

- 30 -

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વેશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે ગુંજ ઊઠતા શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે ધૂજતા નથી અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ વધારીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુસ્સામય શહેર બનાવે. અમને Twitter અને Facebook પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT):

ટ્રાન નુયેન (Tran Nguyen)
હોલ્મ્સ પીઆર (Holmes PR)
416.628.5607, tnuyen@holmespr.com